

## દમદાટી, શિરજોરી, દાદાગીરી

૧. આ એક એવો વિષય છે કે જે માબાપોને વધારે ને વધારે ચિંતા ઉપજાવી રહ્યો છે.
૨. દાદાગીરીને રોકવા માટે શું શું પગલા લેવા એ બાબતમાં તમારા બાળકોની નિશાળમાં શિસ્તપાલનની અમુક ખાસ નિતી હોવી જોઈએ.
૩. તમારા બાળકને કોઈ દમ મારી રહ્યું હોય તો તરત સ્કૂલને જાણ કરો. બનાવ બનતાની સાથે જ મૌખિક રીતે જાણ કરી દેવી અને ત્યાર બાદ લેખિતવાર પાકું કરી લેવું; જે કાંઈ લખો તેની કોપી તમારે રાખવી. બાળકોને દમદાટીના ભોગ બનતા અટકાવવા માટે જે કાંઈ થઈ શકે એ કરવાની જવાબદારી, કાયદા મુજબ, સ્કૂલની છે. કોઈ બાળકને ગંભીર રીતે નુકસાન થાય અને અને આવું નુકસાન થવાનો સંભવ છે એવું અગાઉથી ખ્યાલમાં હોય તો એ સંજોગોમાં દાદાગીરીને રોકવામાં નિષ્ફળ જવા બદલ સ્કૂલને કાયદેસર રીતે દોષપાત્ર ગણી શકાય.
૪. દાદાગીરી બારામાં માબાપોને સ્કૂલ સાથે કોઈ તકરાર હોય તો એક સિદ્ધાંત તરીકે લૉ સેન્ટર, માબાપોને મદદ કરી શકે છે. અલબત્ત, આ વ્યક્તિગત કેસની હકીકત પર આધાર રાખશે. તમે નુકસાનમાં વળતર માટે જો સ્કૂલ સામે કે લોકલ એજ્યુકેશન ઓથોરિટી સામે દાવો મૂકવાના હો તો દાદાગીરીથી બચવા માટે તમારા બાળકને બીજી સ્કૂલમાં દાખલ કરવા માગતા હો તો કાનૂની સલાહ લેવી ખાસ જરૂરી છે. બનવાજોગ છે કે વકીલની દરમ્યાનગીરી જ સ્કૂલને દાદાગીરી અટકાવવા માટે જરૂરી પગલાં લેવા પ્રેરે.

આ પરિપત્રમાં આપેલ માહિતી સાચી તેમ જ આજની તારીખને અનુરૂપ છે તેની બને એટલી ચોકસાઈ રાખવામાં આવી છે. આમ છતાં, કાયદાની દૃષ્ટિએ એને સંપૂર્ણ કે સત્તાવાર ન ગણી શકાય, કાનૂની સલાહ ન કહેવાય, તેની ખાસ નોંધ લેવી. આ માહિતીમાં કોઈ પ્રકારની ભૂલચૂક હોય તેને માટે, કે તેનાથી ઉપજતા માઠા પરિણામ માટે અમોને જવાબદાર ન ઠેરવી શકાય. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં વસતા અને એના કાયદાઓની અસર તળે આવતા લોકો માટે જ આ પરિપત્ર તૈયાર કરવામાં આવેલ છે.

જૂન ૨૦૦૩